



**MAJ-7868**      **Seat No.** \_\_\_\_\_

**Third Year B. Com. (Non CBCS) Examination**

**February - 2018**

**Advance Statistics : Paper - III**

Time : 3 Hours]

[Total Marks : 100

- સૂચના :**
- (૧) દરેક પ્રશ્નના ગુણ સમાન છે.
  - (૨) બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
  - (૩) જમણી બાજુએ ગુણ દર્શિવેલા છે.
  - (૪) આંકડાશાસ્ત્રીય કોષ્ટકોનો ઉપયોગ કરી શકાશે.

**૧ (અ) સમજાવો :** ૧૦

- (૧) બજાર સમતોલપણું
- (૨) ઈજારો.

**(બ) સાબિત કરો કે  $\eta = \frac{A \cdot R}{A \cdot R - M \cdot R}$  બજાર સમતોલ કિંમત અને** ૧૦

$$\text{જથ્થો શોધો } D : p = 46 - 6x^2 \text{ અને } S : p = 6 + 4x + 2x^2$$

**અથવા**

**૧ ટૂંકનોંધ લખો :** ૨૦

- (૧) માંગ અને પુરવઠો
- (૨) માંગની મૂલ્ય સાપેક્ષતા
- (૩) આમદાની વિધેય અને ખર્ચ વિધેય
- (૪) પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા.

૨ (અ) ગ્રાહકનું તુષ્ટિગુણ વિધેય  $U = 4x^3y^3$  અને બજેટ સમીકરણ ૧૦

$x + 2y = 12$  હોય, તુષ્ટિગુણ વિધેયને મહત્વ બનાવે તેવી  $x$  અને  $y$  કિંમતો શોધો.

(બ)  $n$ -ઘાતના સમપરિમાણ ઉત્પાદન વિધેય માટે ઓઈલરનું પ્રમેય લખો અને ૧૦ સાબિત કરો.

### અથવા

૨ સમજૂતી આપો : ૨૦

- (૧) સરેરાશ ઉત્પાદન અને સીમાન્ત ઉત્પાદન
- (૨) તુષ્ટિગુણ વિધેય અને બજેટ સમીકરણ
- (૩) કોબ-ડાલાસ ઉત્પાદન વિધેય
- (૪) ઈજારો અને બે વસ્તુઓનું ઉત્પાદન.

૩ (અ) સરળીકરણનો આંક ૦.૩૦ અને શરૂઆતનું અનુમાન ૧૦૦ લઈને નીચેના ૧૦ જુદા જુદા વર્ષના વેચાણનું પૂર્વનુમાન શોધો :

વર્ષ ( $x$ )	2012	2013	2014	2015	2016
વેચાણ ( $y$ ) (કરોડ ર.માં)	188	199	212	227	231

- (બ) ત્રણ ઉદ્યોગ માટે નીપજક-નીપજ પૃથક્કરણ રીત સમજાવો. ૧૦

### અથવા

૩ (અ) બે ઉદ્યોગ A અને Bનો તાંત્રિક અંકોનો શ્રેષ્ઠિક નીચે પ્રમાણે છે : ૧૦

$$\begin{pmatrix} 0.10 & 0.20 \\ 0.10 & 0.25 \end{pmatrix}$$

જો છેવટની માંગ ઉદ્યોગ-A અને B માટે અનુક્રમે 660 અને 800 થાય ત્યારે ઉદ્યોગ-A અને Bનાં કુલ ઉત્પાદન શોધો.

(બ) નીચેની માહિતી માટે  $y = a + bx + cx^2$  નું અન્વાયોજન કરીને ૧૦  
વર્ષ 2010ની કિંમતનું પૂર્વનુમાન શોધો :

વર્ષ	2004	2005	2006	2007	2008	2009
કિંમત	100	107	128	140	181	192

૪ નીચેની લેટિન ચોરસ યોજના માટે વિચરણાનું પૃથક્કરણ કરો : ૨૦

A 12	C 19	B 10	D 8
C 18	B 12	D 6	A 7
B 22	D 10	A 5	C 21
D 12	A 7	C 27	B 17

### અથવા

૪ એક ગુણાધર્મીય વર્ગીકરણ અને દ્વિગુણધર્મીય વર્ગીકરણ માટે વિચરણાના ૨૦  
પૃથક્કરણાની રીત ઉદાહરણ દ્વારા સમજાવો.

૫ (અ) બે ગુણધર્મોની સ્વતંત્રતાનું પરીક્ષણ કરવાની રીત સમજાવો. ૧૦

(બ) નીચેની માહિતી માટે પોયસન વિતરણનું અન્વાયોજન કરો અને તેની ૧૦  
યોગ્યતાનું પરીક્ષણ વિશે ૫% સાર્થકતાની કક્ષાએ કરો :

પેજ દીઠ ભૂલ સંખ્યા ( $x$ )	0	1	2	3	4
પેજની સંખ્યા ( $f$ )	223	142	48	15	4

#### અથવા

૫ (અ) પ્રકાર-I અને પ્રકાર-II ભૂલો, આગણક અને પ્રાચલની સમજૂતી આપો. ૧૦

(બ) ઉદાહરણો સહિત નિરાકરણીય પરિકલ્પના અને વૈકલ્પિક પરિકલ્પના ૧૦  
સમજાવો.

#### અથવા

૫ (અ) બે પ્રામાણ્ય સમાનિક્ષિતાની વિચરણોની સમાનતાનું પરીક્ષણ સમજાવો. ૧૦

(બ) બે નિરપેક્ષ નિદર્શાની માહિતી નીચે પ્રમાણે છે :

નિદર્શા	મધ્યક	પ્ર.વિ.	પરિમાણ
I	7	5.1	10
II	4	3.33	10

5% સાર્થકતાની કક્ષાએ  $H_0 : \mu_1 = \mu_2$  નું પરીક્ષણ કરો.

## ENGLISH VERSION

**Instructions :** (1) All questions carry equal marks.  
(2) All questions are compulsory.  
(3) Marks indicated on right-side.  
(4) Use of statistical tables is allowed.

- 1** (a) Explain : **10**  
(1) Market Equilibrium  
(2) Monopoly.
- (b) In usual notations prove that  $\eta = \frac{A \cdot R}{A \cdot R - M \cdot R}$  and **10**  
obtain the market equilibrium price and quantity

$$D: p = 46 - 6x^2 \text{ and } S: p = 6 + 4x + 2x^2$$

### OR

- 1** Write short note on : **20**  
(1) Demand and supply  
(2) Price elasticity of demand  
(3) Revenue Function and Cost Function  
(4) Price elasticity of supply.

- 2** (a) Utility function of consumer is  $U = 4x^3y^3$  and budget **10**  
equation is  $x + 2y = 12$ . Find the value of  $x$  and  $y$  such that  
utility function becomes maximum.  
(b) State and prove Euler's theorem for  $n^{\text{th}}$  degree **10**  
homogeneous production function.

### OR

**2 Explain : 20**

- (1) Average Production and Marginal Production
- (2) Utility function and Budget-equation
- (3) Cobb-Web production function
- (4) Monopoly and production of two commodities.

**3 (a) Obtain the forecasting about sales of the following 10 different years taking coefficient of smoothing 0.30 and initial cost 100.**

Year (x)	2012	2013	2014	2015	2016
Sales (y) In crore Rs.	188	199	212	227	231

- (b) Explain method of Input-Output analysis for three industries. 10**

**OR**

**3 (a) Technical coefficient matrix for two industries 10  
A and B given below :**

$$\begin{pmatrix} 0.10 & 0.20 \\ 0.10 & 0.25 \end{pmatrix}$$

Find the total production for each industry for final demands are 660 and 800 respectively.

- (b) For the following data fit  $y = a + bx + cx^2$  and forecast 10 the value of the year 2010 :**

Year	2004	2005	2006	2007	2008	2009
Value	100	107	128	140	181	192

- 4** Analyse the following Latin Square Design : **20**

$A_{12}$	$C_{19}$	$B_{10}$	$D_8$
$C_{18}$	$B_{12}$	$D_6$	$A_7$
$B_{22}$	$D_{10}$	$A_5$	$C_{21}$
$D_{12}$	$A_7$	$C_{27}$	$B_{17}$

**OR**

- 4** Explain the method of analysis of variance for one way classification and two way classification through illustration or examples. **20**
- 5** (a) Explain the method of test of two independent of two attributes. **10**
- (b) Fit Poisson Distribution to the following data and test the goodness of fit at 5% level of significant. **10**

No. of errors per page ( $x$ )	0	1	2	3	4
No. of pages ( $f$ )	223	142	48	15	4

**OR**

- 5** (a) Explain : Type-I and Type-II errors, Statistic and parameter. **10**
- (b) Explain : Null Hypothesis and Alternative Hypothesis with illustrations. **10**

**OR**

- 5** (a) Explain the method to test the significance of equality of two variances of two normal populations **10**
- (b) For two independent sample of the following information obtained. **10**

Sample	Mean	S.D.	Size
I	7	5.1	10
II	4	3.33	10

Test  $H_0: \mu_1 = \mu_2$  at 5% level of Significance.

---